

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૭/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૭૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી, ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૫૧૯ લીટર દેશી દારૂ, ૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૯૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૫૭ બિયર ટીન અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૪,૩૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૭૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૩૮૦/૧૮

માધવપુરા: નરેશ અશોકકુમાર આશવાણી (રહે.પાર્શ્વનાથનગર જનતાનગર ચાંદખેડા) એ તા.૧૯/૭/૧૮ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે શાહીબાગ લક્ષ્મી સ્ટોલ શ્રીજી કોમ્પલેક્ષ ખાતે નરેશ આશવાણીની ઓફિસમાં છેલ્લા આઠેક વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો આરોપી મનસુખ હિરાભાઈ પ્રજાપતી (રહે.લાખાજી કુવરજી હોલની સામે, બારડોલપુરા, માધવપુરા) તા.૧૬/૭/૧૮ કલાક ૧૧/૦૦ વાગે છોટા હાથી ગાડી લઈ રખીયાલ ગોડાઉનથી માલ લઈ ઓઢવ ખાતે કેવલભાઈની દુકાને માલ ખાલી કરી કેવલભાઈએ આપેલ રોકડ રૂપિયા ૫,૦૦,૦૦૦/- નરેશ આશવાણીને નહીં આપી નાસી જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એન.પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૮૧/૧૮

વાડજ: સુરેન્દ્રભાઈ દિપચંદભાઈ જૈન (રહે. રોનક પાર્ક સોસાયટી અંબીકા ચાર રસ્તા રાણીપ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૭/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે રત્ન જ્યોત કોમ્પલેક્ષ નિર્ણયનગર ખાતે દુકાન નં ૩૧ વીર ફાર્મસી નામની મેડીકલ દુકાનનું તાળુ તોડી અજાણી વ્યક્તિ દુકાનમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ તથા કોસ્મેસ્ટિક સામાન જેની આશરે કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- તેમજ રોકડ રૂપિયા ૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એન.એન.ચૌધરી ચલાવે છે.

સાબરમતી: કીશોરભાઈ ગફરુભાઈ દાતણીયા (ઉ.વ.૫૧) (રહે. પાટણવાડીયાની ચાલી શાહપુર દરવાજાની બહાર શંકરભુવન) એ તા.૧૯/૭/૧૮ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૭/૧૮ રાતના ૧૦/૪૫ વાગ્યાના સુમારે કીશોરભાઈ દાતણીયાના પત્ની મીનાબહેન (ઉ.વ.૪૫) જીજે ૦૧ ડીટી ૧૫૯૩ લોડીંગ રીક્ષામાં બેસી સાબરમતી પાવરહાઉસ સર્કલ નજીક બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે ૦૧ ડીટી ૧૫૯૩ લોડીંગ રીક્ષાના ચાલકે રિક્ષા પુરઝડપે અને બેદરકારીથી ચલાવતા રિક્ષા પલ્ટી ખાતા મીનાબહેનને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.એમ.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

શહેરકોટડા: બાબુભાઈ ગણેશભાઈ પટણી (ઉ.વ.૫૯) (રહે. જજ સાહેબની ચાલી વખાપારાના છાપરાં શારદાબેન હોસ્પિટલની બાજુમાં સરસપુર) એ બિમારીથી કંટાળી તા.૧૯/૭/૧૮ સાજના ૬/૦૦ વાગ્યા પહેલા જી.સી.એસ હોસ્પિટલના ચોથા માળેથી પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમીરભાઈ અળસીભાઈ ચલાવે છે.

સરદારનગર: દુરીબહેન લાલજીભાઈ વાઘેલા (રહે. નહેરુનગરના છાપરાં કેવલ કચોરીની પાછળ શાસ્ત્રીચોક કુબેરનગર સરદારનગર) એ અગમ્ય કારણસર તા.૧૯/૭/૧૮ નારોજ પોતાના ઘરે કેરોસીન છાટી સળગી ગયા હતા. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી આઈ.કે.મોથલિયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.